Aug' 2025

4th

Aug' 2025

4th

Aug' 2025

Aug' 2025

Aug' 2025

Aug' 2025

Date of Demand Notice & Total Outstanding Dues (Rs.)

20-May-2025/ Rs. 8,29,509/- Rupees Eight Lakh Twenty Nine Thousand Five Hundred

Nine Only.

20-May-2025/ Rs.

9,80,485/- Rupees Nine Lakh Eighty Thousand Four Hundred Eighty Five Only.

20-May-2025/ Rs.

,38,189/- Rupees Sever Lakh Thirty Eight Thousand One Hundred Eighty Nine Only.

20-May-2025/ Rs.

6,87,217/- Rupees Six Lakh Eighty Seven Thousand Two Hundred Seventeen Only.

20-May-2025/ Rs. 4,76,395/- Rupees Four

Lakh Seventy Six

Thousand Three

Hundred Ninety Five Only.

20-May-2025/ Rs.

6,07,929/- Rupees Six Lakh Seven Thousand

Nine Hundred Twenty

Nine Only.

Sd/- Authorized Officer, Muthoot Homefin (India) Limited

## SANRHEA

## SANRHEA TECHNICAL TEXTILES LIMITED

CIN: L17110GJ1983PLC006309

Regd Office: Parshwanath Chambers, 2nd Floor, Nr. New RBI, Income Tax, Ahmedabad - 380 014. Phone: (02764) 225204 E-mail: sanrhea@gmail.com Website: www.sanrhea.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2025

(Rs. In Lakhs Except EP									
		Quarte	Year Ended						
Sr. No.	Particulars	30.06.2025	30.06.2024	31.03.2025					
140.		Unaudited	Unaudited	Audited					
1	Total Income from operations	1776.31	1692.55	7512.53					
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional								
	and/or Extraordinary items)	133.72	132.38	640.62					
3	Net Profit / (Loss) for the period before tax (after								
	Exceptional and/or Extraordinary items)	133.72	132.38	640.62					
4	Net Profit / (Loss) for the period after tax (after								
	Exceptional and/or Extraordinary items)	99.34	95.51	472.48					
5	Total Comprehensive Income for the period [Comprising								
	Profit / (Loss) for the period (after tax) and Other								
	Comprehensive Income (after tax)]	96.99	93.70	463.08					
6	Equity Share Capital	569.00	500.00	500.00					
7	Reserves (excluding Revaluation Reserve) as shown in								
	the Audited Balance Sheet of the previous year	-	-	2030.18					
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing								
	and discontinued operations)								
	(a) Basic	1.84	1.91	9.45					
	(b) Diluted	1.84	1.91	9.45					
Note	: The above is an extract of the detailed format of Quarterly Financial	Results filed with the	e Stock Exchanges	under Regulation 33					

of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are ailable on the Stock Exchange website www.bseindia.com and on Company's website www.sanrhea.com

Place: Ahmedabad Date: 08.08.2025



For SANRHEA TECHNICAL TEXTILES LIMITED

Sd/-**Tushar Patel (Managing Director)** DIN: 00031632

OA No. 1439/2019



### **Government of India Ministry of Finance**

## **DEBTS RECOVERY TRIBUNAL-II**

4th Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram Paldi, Ahmedabad, Gujarat.

FORM NO. 22 (Earlier 62) [Regulation 36 & 37 of DRT Regulations, 2015] [See Rule 52(1) (2) of the Second Schedule to the Income Tax Act, 1961] READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTORS ACT, 1993. E-AUCTION / SALE NOTICE [THROUGH REGD.AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM/PUBLICATION]

RP/RC NO. 221/2021 The Federal Bank Ltd.

**Certificate Holder Bank** 

Mr. Minal Ramniklal Shah & Anr. Certificate Debtors

C.D. No. 1: Mr. Minal Ramniklal Shah,

107, Ambe Residency, Nr. Rumta Hospital, B/h. Reliance Fresh, Sevashram Road, Bharuch, Gujarat - 392001 And also at: 4, R Niwas, Opp. Akash Ganga Flat, Nilkanth Mahadev Road, Bharuch, Guiarat - 392001

C.D. No. 2: Mrs. Ilaben Minal Shah,

107, Ambe Residency, Nr. Rumta Hospital, B/h. Reliance Fresh, Sevashram Road, Bharuch, Gujarat - 392001

And also at: 4, R Niwas, Opp. Akash Ganga Flat, Nilkanth Mahadev Road, Bharuch, Gujarat - 392001. The aforesaid CDs No. 1 to 2 have failed to pay the outstanding dues of Rs. 1,46,50,002/- (Rupees One Crore Forty Six Lakhs Fifty Thousand Two Only) as on 28.12.2019 including interest in terms of judgment and decree dated 16.06.2021 passed in O.A. No. 1439/2019 as per my order dated 01.08.2025 the under mentioned property(s) will be sold by public e - auction in the

aforementioned matter. The auction sale will be held through "online e- auction" website : https://www.bankeauctions.com. Reserve Price EMD 10 % or Description of the Properties (Rounded off) Shop No. 109 & 110, First Floor, Emerald Business Hub, bearing Revenue Survey

No. 48 Paiki & 49 paki, Final No. 3/2 + 8/2 as per TP Scheme No. 2 (Part - 1) paiki Rs. 51.00 Rs. 05.10 Mouje - Aali, Dist. Bharuch, **Bounded by :- East :** by 10, West : Parking Place Lakhs North: Parking Place, South: by Road of Basement.

Note\* In respect of any claims to be received, if any, priority of payment will be decided in terms of Section 31-B of the RDB Act, 1993 (as amended in the year 2016).

EMD shall be deposited by through RTGS / NEFT as per details as under:

Beneficiary Bank Name	Federal Bank Ltd						
Beneficiary Bank Address	LCRD / Ahmedabad Division						
Beneficiary Account	06102200000014	IFSC Code	FDRL0000610				

1. The bid increase amount will be Rs. 25,000/- for Lot No. 1.

Prospective bidders may avail online training from service provider C1 India Pvt. Ltd. (Tel. Helpline No. 7291981124 / 1125 / 1126 and Mr. Bhavik Pandya (Mobile No. 8866682937), Helpline E - Mail ID : support@bankeautions.com and for any property related queries may contact Mr. Shailendra Kumar Pandey (M : 8606145550). Prospective bidders are advised to visit website https://www.bankeauctions.com for detailed terms & conditions and

procedure of sale before submitting their bids. The prospective hidders are advised to adhere payment schedule of 25% (Minus FMD) immediately after fall of hammer / close of

Auction and 75 % within 15 days from the date of auction and if 15th day is Sunday or Other Holiday, then on immediate next first bank working day. No request for extension will be entertained.

The properties are being put to sale on "AS IS WHERE IS", "AS IS WHAT IS" AND " AS IS WHATEVER" basis and prospective buyers are advised to carry out due diligence properly.

Schedule of auction is as under

BANGO

**SCHEDULE OF AUCTION** 



(with auto extension clause of 03 minutes, till e-auction ends)



Recovery Officer - I Debts Recovery Tribunal - II,

## Tender for acquiring premises on lease for Gotri-Sevasi Road Branch

Bank of Baroda, Baroda City Region, invite offers from the owners/Power of Attorne Holders of premises, preferably on the ground floor with carnet area of 2000 to 2350 sq f or housing proposed Gotri-Sevasi Road Branch. Premises to be located, preferably o Gotri Sevasi Road, at a prominent place in the vicinity of the junction of Gotri Sevasi Road and evasi Canal Road and should include all facilities, including adequate power

The premises shall be ready for occupation or likely to be ready for occupation within period of -1- month. The intending offers shall submit their offers in two separate sealed covers superscribed "Technical Bid" and "Financial Bid" to The Regional Head Bank of Baroda, Baroda City region, 5th Floor, Suraj Plaza III, Sayajigunj, Vadodara 390005 on or before 30.08.2025 till 3:00PM. Priority would be given to the premises pelonging to public sector units/Goyt. Departments (for details please login on tende section of our website **www.bankofbaroda.com**). The Bank reserves its right to accept or reject any offer without assigning reasons thereof

Date: 09.08.2025

Regional Head Baroda City Region

Muthoot Homefin

edeem the secured assets Sr. Name of the Borrower(s)/ Co-Borrower(s)/ Loan Account No./Branch

Shankarbhai Harijan/ yotiben Nareshbhai Harijan/ 004-

Sunil Omprakash Dubey/ Shilpidevi Suni Dubey/ 004-00402071/ Surat

Sanjaybhai Jagnarayan Panday/ Chanda Sanjay Pandey/ 004-00402850/ Surat

Kalla Parsing Damor/

004-00402873/ Surat

Kallu Dilipsingh Rajput/

Raiput/ 004-

00404007/ Surat

Yuvrajbhai Sahebrao

Shinde/ Ushaben Yuvrajbhai Shinde/

Date: August 09, 2025, Place: Surat

004-00404221/ Surat

00000213/ Surat

Nareshbhai

Baroda Branch, Ground Floor, इंडियन बैंक Indian Bank N.Z. Plaza, Ghee Kanta Road, Raopura, Vadodara-390001 POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Where as, The undersigned being the Authorized Officer of the Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 16/04/2025 Calling upon the borrower Shri Ashok Parmar Proprietor of M/s Velcon Ai Corporation, Mr. Bansibhai Patel (Guarantor) and Mrs. Punita Parmai (Guarantor) with our Baroda Branch to repay the amount mentioned in the notice being Rs.1,68,08,247.00 (Rupees One Crore Sixty Eight Lakhs Eight Thousand Two Hundred Forty Seven Only) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under Section 13 (4) of the said Act read with Rule 8 and 9 of the said rules on this 8th day of August of the year 2025

The borrower in particular and the public in general is hereby cautioned no to deal with the property and any dealings with the property w the charge of the Indian Bank for an amount of Rs.1.68.08.247.00 (Rupee One Crore Sixty Eight Lakhs Eight Thousand Two Hundred Forty Sever only)and interest thereon

The Borrower's attention is invited to provision of sub-section (8) of section

13 of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Property No. 1: All the piece and parcel of land/building situated at G1 ARK AVENUE, 35, Sampatrao Colony, RC Dutt Road, Alkapuri, Vadodara 395005 in the name of Mr. Ashok Parmer. East: way to upper floor of the apartment, West: Flat No G-2, North: Main Road, South: Parking place. roperty No. 2: All the piece and parcel of land/building situated at G2 LARK AVENUE, 35, Sampatrao Colony, RC Dutt Road, Alkapuri, Vadodara 395005 in the name of Mr. Ashok Parmer, East; way to upper floor of the apartment, West: Flat No G-1, North: Main Road, South: Parking place. Date: 08/08/2025 **Authorised Office** 

Salabatpura Branch, 1st Floor, 21st Century यूको बैंक UCO BANK Building, Ring Road, Surat - 395009. E-mail : salaba@ucobank.co.in

### The Security Interest Enforcement Rules, 2002 Rule 8(1) POSSESSION NOTICE (For Immovable Property) Whereas. The undersigned being the authorized officer of the UCO Bank Salabatoura

Branch Surat under the Securitization and Reconstruction of Financial Assets and nforcement of Security Interest Act 2002 (54 of 2002) and in exercise of powers onferred under Section 13(12), 13(2) read with rule 3 of the Security Interest Enforcement) Rules, 2002 issued a demand notice dated 12/05/2025 calling upor he Mr. Ketan Ravjibhai Adroja, Mrs. Shilpaben Ketanbhai Adroja, to repay the amount mentioned in the notice being Rs. 9,88,230.74 (Nine Lakh Eighty Eight Thousand Two Hundred Thirty And Paisa Seventy Four Only) inclusive of interest upto 30/09/2024 (Less Credit if any) in account no. 01770610006535 as on 29/01/2025. Borrower is also liable to pay future interest at the contractual rate on the foresaid amount together with incidental expenses, cost, charges, etc. as mentioned nnotice, within 60 days from the date of receipt of the said Notice.

he borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on im under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 of the security interes inforcement Rules 2002 on this 07th day of August of the year 2025. The borrower/guarantor in particular and the public in general is hereby cautioned not

to deal with the property and any dealings with the property will be subject to the charge of the UCO Bank Salabatpura Branch Surat for an amount Rs. 9,88,230.74 Nine Lakh Eighty Eight Thousand Two Hundred Thirty And Paisa Seventy Four Only) inclusive of interest upto 30/09/2024 (Less Credit if any) in account no. 01770610006535 as on 29/01/2025 and interest & Other Charges thereon with effect from 29.01.2025 (Amount deposited after issuing of demand notice U/Section 13(2) has given effect).

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

**Description of the Immovable Property** 

All the plece and parcel of Plot No. 168 admeasuring 40.15 Sq. Mtrs. With proportionate undivided Inchoate share of Road and C.O.P. admeasuring 24.69 Sq. Itrs. In Raj Nanadini Residency Vibhag-2, with all appentencies pertaining thereto standing on Land bearing Block No. 137, Lying, being and situated at Village : Umara Sub-District : Olpad, District : Surat, Property in the name of Mr. Ketan Ravjibha Aadroja, Boundaries : East : Plot No. 167, West : Plot No. 169, North : Plot No. 161 South: Society Internal Road.

Authorised Officer, Date: 07/08/2025 | Place: Surat UCO Bank



## **DEBTS RECOVERY TRIBUNAL-I**

Ministry of Finance, Department of Financial Service, Government of India
4th Floor, Bhikhubhai Chambers, Nr. Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad-380 006 FORM NO.22 (Earlier 62) [Regulation 37 (1) DRT Regulations, 2015] [See Rule 52 (1) of the Second Schedule to the Income-tax Act, 1961]

Muthoot Homefin (India) Ltd.

POSSESSION NOTICE (As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

POSSESSION NOTICE (As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002) Whereas, the undersigned being the Authorized Officer of Muthoot Homefin (India) Ltd. (MHIL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest(Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s)/ Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s)/ Consorrower(s)/ Guarantor(s) and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property will be subject to the charge of Muthoot Homefin (India) Ltd. for an amount as mentioned herein under with interest thereon.

The Borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

Brief details of secured assets

Plot No. 27, Krishna Villa-1 Survey No. 301/B Location Gangadhara To Kareli Road Landmark Gangadhara Fatak Village No. Kareli District Surat State Gujrat Country India Pincode- 394310. Directions North-Plot

Io. 28, South- Plot No. 26, Soc Road, West - Other Plo

Flat No. P- 301 (AS Per Plan, Building No. C-3) Building Name & No. Vraj Bhoomi Apt. Survey No. Moje Gam: Bhestan, Old R.S. No. 153, New R.S. No. 113. T.P.S. No. 48 (Bhestan), F.P. No. 7. Location Bhestan Landmark Near Sai Raj Residency City Name Surat District Surat State Gujrat Country India Pincode 394210. Directions North-Stair, South-O.T.S, East-Socienty Road, West-Passage

Flat No. 101, 1st Floor, Rudraksh Residency, Soni Park

Flat No. 101, 1st Floor, Rudraksh Kesidency, Soni Park Housing Society- 2, Tatithaya, Palsana, Surat Survey No. Block No. 2 Landmark Soni Park Housing Society-District Surat State Gujrat Pincode 394305. Directions North- Adj. Block, South- Adj. Building, East- Internal Road, West- C.O.P.

Flat No. A 503, 5th Floor Mahalaxmi Residency, Wing- A,

Yogidarshan Society, Behind S.D. Jain School, Highway No.8, Surat- Mumbai Highway, Palsana, Surat Survey No. R.S. No. 525, Block No. 526/P, Landmark Behind S.D. Jain School, Highway No. 08 District Surat State Gujrat Pincod 394315. Directions North- Open Plot, South- Wing-A, East- Adj. Society Road, West- Adj. Society Road

Flat No. A 105, 1st Floor, Satyam Residency- A, Opposite Sahiba Mill, Off. Surat- Bardoli Highway, Jolwa, Palsana,

Surat, Gujrát Survey No. R.S. No. 159/2/A/, 159/2/B, Bĺoc No.: 183, 184, Plot No. 17,18,19 Landmark Opposite

Sahiba Mill, Near Jolwa Road District Surat, State Gujrat Pincode 394310. Directions North- Road, South- Adj. Building, East- Adj. Plot, West- Society Marjin

Flat No. A-303, 2nd Floor, Radhe Residency- A, Sai Vatika Row House Vibhag-2, Off- Surat Bardoli

lighway, Bagumara, Palsana, Surat Survey No. R.S.-109, Block No. 273 Landmark Sai Vatika Row House

icos, Bock No. 275 Landmark Sai Vattika Row nouse Vibhag-2 District Surat State Gujrat Pincode 394327. Directions North- Open Plot, South- Society Road, East- Society Road, West- Society Road

Flat No. P. 501 (As Per Plan, Building No. C-5) Building

Corporate Office : Unit No. 19-NE, 19th Floor, The Ruby, Senapati Bapat Marg, Near Ruparel College, Dadar (West), Mumbai, Maharashtra- 400 028

E- AUCTION/SALE NOTICE THROUGH REGD. AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM PROCLAMATION OF SALE UNDER RULES 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961 READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993 O.A. No. 466/2015 R.C. No. 171/2018

Certificate Holder:-BANK OF BARODA

Certificate Debtors :- M/S. Good Luck Polytech & ORS

CD No. 1: M/s. Good Luck Polytech

Proprietorship firm having sole proprietor Mr. Mukesh Himatbhai Kavani 10, Panchratna Estate, Near Zaveri Ind. Estate, Singwara Road, Kathwada, Ahmedabad, Gujarat-382430

CD No. 2: Mr. Mukesh Himatbhai Kavani 10, Panchratna Estate, Near Zaveri Ind. Estate, Singwara Road, Kathwada, Ahmedabad, Gujarat-382430

CD No. 3: Mr. Ashokkumar Popatlal Patel 15, Green dhara Apartment, India Colony, Bapunagar, Ahmedabad.

The under mentioned property will be sold by Public E-auction sale on 18th day of September, 2025 for recovery of sum

of Rs. 27.97.423/-(Rupees: Twenty Seven Lacs Ninety Seven Thousand Four Hundred Twenty Three only) plus interest and cost payable as per Recovery Certificate issued by Hon'ble Presiding Officer, DRT-I (less amount already recovered, if any), rom M/s. Good Luck Polytech & Ors. **DESCRIPTION OF PROPERTY** 

of	Description of the Property to be sold with the names of the co- owners where the property belongs to defaulter and any other person as co-owners	Reserve Price below which the property will not be sold	
1	2	7	8
Lo No		Reserve Price (in ₹)	10% EMD (in ₹)
1	Flat No. 15, Fourth Floor, "Greendhara", B/s. Radhe Apartment, Opp. Jamnotri Apartment, Nr. Narol-Naroda Road, Bapunagar, Ahmedabad	₹ 8,50,000/-	₹ 85,000/-

3. Revenue assessed upon the property or any part thereof - Not known

 Details of any other encumbrance to which property is liable - Not known 5. Valuation also state Valuation given, if any, by the Certificate Debtor - No

6. Claims, if any, which have been put forward to the property, and any other known particulars bearing on its nature and value - Not known

Auction/bidding shall only be through online electronic mode through the e-auction website i.e. https://baanknet.in

The intending bidders should register the participation with the service provider-well in advance and get user ID and password fo participating in **E-auction**. It can be procured only when the requisite earnest money is deposited in prescribed mode below

EMD shall be deposited latest by till 04:00 PM on 16.09.2025 in Wallet Bank Asset Auction Network (BAANKNET https://baanknet.in. EMD deposited thereafter shall not be considered for participation in the e-auction In addition to above the copy of PAN Card, Address Proof and Identity Proof, F-mail ID, Mobile Number, in case of the company

copy of board resolution passed by the Board of Directors of the company or any other document confirmin representation/attorney of the company and the Receipt/Counter File of such deposit should reach to the said service provide through e-auction website by uploading softcopies on or before till 4:00 PM on16.09.2025, and also hard copies alongwith EMDs deposit receipts should reach at the Office of Recovery Officer-I, DRT-I, Ahmedabad by 16.09.2025. It is also held that earnes money of unsuccessful bidders shall be returned back in the respective accounts such bidders through the same mode of payment. Prospective bidder may avail online training from service provider:

Name of Auction Agency Bank Asset Auction Network (BAANKNET) Contact person Mr. Kashyap Patel (Mobile No. 9327493060) Helpline Nos. 8291220220 **Helpline Email Address** Support.BAANKNET@psballiance.com Name: Mr. A.K. Chaudhary (Chief Managar) Mobile No. +91 7486013985

Prospective bidders are advised to visit website https://baanknet.in. for detailed terms & conditions and procedure of sal before submitting their bids

The property shall not be sold below the reserve price.

The property shall be sold in 1 lots, with Reserve Price as mentioned above lot. The bidder shall improve offer in multiples of ₹ 10,000/- during entire auction period.

10. The property shall be sold "AS IS WHERE IS BASIS" and shall be subject to other terms and conditions as published on the official website of the e-auction agency.

11. The highest bidder shall have to deposit. 25% of his final bid amount after adjustment of EMD already paid in Wallet Bank Asse Auction Network (BAANKNET) https://baanknet.in by immediate next bank working day by 4:00 P.M. through RTGS/NEFT as pe the details as under

Bank of Baroda Bank Name **Account Name** New Intermediary Account 59950015181219 Account No. BARB0SARAHM (Fifth character of IFSC Code is numeric zero '0') IFSC Code No. **Branch Address** Regional Stressed Assets Recovery Branch, First Floor, Surya Complex Opp. The Golden Times, Near Swastik Cross Road, Navranepura Ahmedabad - 380009

12. The successful bidder/auction purchaser shall deposit the balance 75% of sale consideration amount on or before 15th day from the date of sale of the property. If the 15th day is Sunday or other Holiday, then on immediate first bank working day through RTGS/NEFT in the account as mentioned above. In addition to the above, the purchaser shall also deposit poundage fee @1% on total sale consideration money (plus ₹ 10) through DD in favour of The Registrar, DRT-I. Ahmedabad. The DD prepared towards poundage's fees shall be submitted directly with the office of Recovery Officer, DRT-I. Ahmedabad.

13. In case of default of payment within the prescribed period, the deposit, after deduction the expenses of the sale, may, it the undersigned thinks fit, be forfeited to the Government Account and the defaulting purchaser shall forfeit all claims to the property or the amount deposited. The property shall be resold forthwith, after the issue of fresh proclamation of sale. Further the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which it is subsequently sold.

The successful bidder should note that TDS and GST liability, if any, arising out of sale of properties will have to be borne by the successful bidder separately over and above the sale consideration amount and shall not be deducted from sale consideration

amount confirmed by this forum 15. Schedule of auction is as under:

Last date of submissions of hard copies ' of proof of EMD Up to 05:00 pm 16.09.2025 /documents with office of the Recovery Officer-1 Date and Time of E-Auction Between 12:00 Noon to 01:00 pm (with auto extension clause of 5 minutes, till Auction completes)

16.09.2025

16. The Recovery Officer has the absolute right to accept or reject any bid or bids or to postpone or cancel the e-auction without assigning any reasons Sd/- (Love Kumar Seal

ssued under my hand and seal of this Tribuna

Recovery Officer-I, DRT-I, Ahmedabad

# **BANCO PRODUCTS (INDIA) LIMITED**

Regd. Office: Bil, Near Bhaili Rly. Station, Padra Road, Dist. Vadodara - 391 410. Tel. No.: (0265) 2318226 CIN NO:- L51100GJ1961PLC001039, Website:- www.bancoindia.com, E-mail:- investor@bancoindia.com

								(NS. III Lakiis)
		Standalone Consolidated						
Particulars	Quarter ended	Quarter ended	Quarter ended	Year ended	Quarter ended	Quarter ended	Quarter ended	Year ended
	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025	30.06.2025	31.03.2025	30.06.2024	31.03.2025
	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE OUARTER ENDED 30TH JUNE, 2025

31,238 41,028 25,812 124,902 98,385 89,344 80,597 325.554 Total income from Operations Net profit /(loss) for the period (before tax, exceptional 6,372 15,201 3,753 31,121 16,425 18,967 10,851 53,421 and/or extra ordinary items) 6,372 15,201 3,753 31,121 16,425 18,967 10,851 53,421 Net profit /(loss) for the period before tax (after exceptional and/or extra ordinary items) Net profit /(loss) for the period after tax 4,790 13,733 2,779 26,626 10,952 15,350 6,867 39,180 (after exceptional and/or extra ordinary items) 13.677 26,570 Total Comprehensive Income for the period 4.790 2.779 16,406 14,727 8.484 40.867 (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) 2.861 1,430 2,861 2,861 2,861 2.861 2.861 1,430 **Equity Share Capital** Reserves (excluding Revaluation Reserve as shown in Rs.82,144/-Lakhs as on 31st March 2025 Rs.1,27,368/- Lakhs as on 31st March 2025 the Audited Balance Sheet of previous year) Earning per share (of Rs. 2 /- each) (for continuing and discontinued operations) 3.35 9.60 18.61 27.39 **Basic** 1.94 7.66 10.73 4.80

Note: (1) The above is an extract of the detailed format of the Unaudited Financial Results of the Company for the Quarter ended 30th June, 2025 filed with the Stock Exchange under  $Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) \, Regulations, 2015. The full format of the Quarter ended \, 30th June, 2025 are available on the website of the Company of$ BSE Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company at www.bancoindia.com. (2) The above results (Standalone and Consolidated) have been prepared in accordance with Indian Accounting Standards ('IND AS) notified under section 133 of the companies Act 2013, reac together with relevant rules is sued there under and other accounting principles generally accepted in India. During the year 2024-25, 7,15,18,650 equity shares of Face Value of Rs.2/- were allotted to the eligible holders of equity shares on the record date (i.e. 30.12.2024) as bonus equity shares by Capitalizing Securities Premium Rs.1200.31 Lakhs and General Reserve Rs. 230.06 Lakhs. In accordance with the 'Ind AS 33 - Earning per share', the figures of Earning Per Share for the period June'24 has been restated to give effect to the allotment of the bonus shares.

9.60

For Banco Products (India) Limited (Mehul K Patel Chairman



Place: Vadodara

Date: 08.08.2025

Diluted





3.35





18.61











Date and Time of Inspection

Date of uploading proof of EMD

documents on F-auction website

on this 14th Day of July, 2025.







02.09.2025 Between 02:00 PM to 04:00 PM

Up to 04:00 pm



### આજવા રોડ શાખા, દુધેશ્વર નગર, પાણીની ટાંકી, यूको बैंक **( UCO BANK** आल्या रोड, वडोहरा-३९००१९. झेन : 0265-2512131

# ભરૂચમાં રક્ષાબંધન નિમિતે છેલ્લીઘડીએ ખરીદી નીકળતા વેપારીઓમાં ખુશી Required Male - Female (Staff

સજધજ થઈ પોતાના ભાઈઓને જ પતિને લઈ મોટરવાહનો લઈ

ભરૂચ,તા.૮ તહેવાર રક્ષાબંધન ઉજવવા દોડી બાપ, ભાઈ, ભાભી આવકાર આપી વચન આપતા હોય છે. હિન્દૂ મુસ્લિમ શ્રાવણ વદ પૂનમના દિવસે બહેનો આવે છે. ત્યારે બીજી તરફ ભાઈઓ એકબીજાને ભેટી પડે છે. કુટુંબી હોય સહિતના ધર્મની બહેનો ભાઈઓને પણ બહેનો, ભાશેજ અને જમાઈની રાખડી બાંધવા દોડાદોડ કરતી હોય આતુરતાથી રાહ જોતા હોય છે. નવા છે. પરિણત બહેનો વહેલી સવારથી કપડાં પહેરી નાના ભૂલકાઓ પણ જુદા જુદા કાર્ટૂન, મ્યુઝિક-લાઈટ કે અવનવી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ, ટ્રેનમાં ડિઝાઇનવારી રાખડી બાંધવા આવશે કિલોમીટરો સુધીની મુસાફરી ખેડી તેમ નાની નાની બહેનોની રાહ જોતા હરખઘેલી બની ભાઈના ઘરે પવિત્ર હોય છે. બહેન ઘરમાં પ્રવેશતાં જ માં

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી.

રાયગક બરાનપુરા, વકોદરા. મો. 9737415757 / 6356415757

વાર્ષિક સાધારણ સભા

મંડળીના તમામ સભાસદ ભાઇ–બહેનોને જણાવવાનું કે મંડળીની

૮૫મી વાર્ષિક સાધારણ સભા રવિવાર તા. ૨૪/૦૮/૨૦૨૫ ના

રોજ સવારે ૧૦:૦૦ કલાકે શ્રી કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ,

આર.વી દેસાઇ રોક, ગંગોત્રી એપાર્ટમેન્ટ પાછળ, વકોદરા સ્થળે

નોંધ ઃ વાર્ષિક સાધારણ સભા પુર્ણ થયા બાદ સભાસદો માટે અલ્પાહાર

રાખેલ છે. જે માટે સભામાં હાજર રહી કુપન મેળવવાનું રહેશે. સભા સમચે

હાજર રહેનાર સભાસદ જ અલ્પાહારનું કુપન મળશે. સભા પૂર્ણ થયા બાદ

આવેલ સભાસદને કૂપન મળશે નહીં તથા બિન સભાસદને પણ કૂપન

આપવામાં આવશે નહીં.તથા સભાસદે માસિક બચતની પાસબુક ફરજિયાત

શ્રીક્રાંત સા. સાળુંક્રે અહુલ અ. ગુડગુડે ગૌરવ ૨. પવળે

MADHYA GUJARAT VIJ COMPANY LIMITED

Baroda City Circle, Navlakhi Compund, Baroda-390001

Website: www.mgvcl.com E&P

Dept-GOG: http:/guj-epd.gov.in

**TENDER NOTICE** 

Sealed tenders are invited for (1) Supply of Branded 185 sqmm

xlpe 11 KV STRAIGHT JOINT CABLE BOX for Underground cable

ND, DISS schemes works & Maintenance work for power supply

restoration under jurisdiction of ALL SDN of Lalbaug Division (CFC)

MGVCL (2) Supply of Branded 185 sqmm xlpe 11 KV OUTDOOR

JOINT CABLE BOX for Underground cable ND, DISS schemes works & Maintenance work for power supply restoration under jurisdiction

of ALL SDN of Lalbaug Division (CFC) MGVCL (3) ARC for Erection

& Maintenance of HT, LT, TC Erection under Jurisdiction of GIDC S/ Dn. Or Any other S/Dn. Of LALBAUG Division. (4) ARC for Erection

& Maintenance of HT, LT, TC Erection under Jurisdiction of TARSAL

Note: Tender Papers & Specifications etc. may be down loaded from

Web site https:tender.nprocure.com(For view, download and online

submission) & GUVNL/MGVCL web sites www.guvnl.com & www.

mgvcl.com(For view & down load only). Be in touch with our GUVNL

MGVCL website & n-procure website till opening of the tender.

Superintending Engineer (O&M) Baroda City Circle

A Nippon india Mutual Fund

11th Aug, 2025

Mutual Fund Investor Awareness Program

06:30 Pm

Nippon Life India Asset Management Limited | CIN: L65910MH1995PLC220793

Venue: Keys Lite (by Lemon Tree Hotels). Samruddhi Trade Centre, Waghodia

Dabhoi Ring Road, Vadodara - 390025

MADHYA GUJARAT VIJ COMPANY LIMITED

O&M CIRCLE OFFICE, GOTRI ROAD, BARODA-390 021 Tel: 2355520/21 Fax 2313164

barodaom\_exp@gebmail.com E&P Dept-GoG: http://guj-epd.gov.in

CIN U40102GJ2003SGC042907

Nivida 22/25 - Tender Notice

Tender Notice: (1) Tender notice No. MGVCL/Civil/VN/S W Pool/2025/Aug/1, Biennial Contract

for Operation and Maintenance of Swimming pool at Vidhyut Nagar Colony, Vadodara 2025-27. (2)

Tender notice No.E.E. (O&M)/BD/Aug-25/2, Miscellaneous civil maintenance works in S S Colony

& Other places at Vidhyut Nagar Colony. (3) Tender Notice No: BC/Fire Ext/2025-26/ (Short Tender

Notice), Name of Work:-Supply and installations of Fire Extinguishers at the various offices under

પશ્ચિમ રેલવે - અમદાવાદ મંડળ

<u>વોક - ઇન - ઇન્ટરવ્યૂ</u> અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલવેમાં કરારના આધારે મહેસૂલ વિભાગના નિવૃત્ત રાજ્ય સરકારના અધિકારીઓની પુનઃનિમણૂક માટે વોક - ઇન - ઇન્ટરવ્યૂ

સૂચના નંબર EE/891/1 (પુનઃનિમણુક-જમીન સેંપાદન) તારીખ: 06.08.2025

મહેસૂલ વિભાગોમાંથી નિવૃત્ત રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી GP માં 4200 થી 5400 અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારે

પાસેથી 21.08.2025 ના રોજ સવારે 10.00 વાગ્યાથી યોજાનાર વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે પરિશિષ્ટ 'A' મુજબ જોડાયેલા ફોર્મેટમાં અરજીઓ

**4) અનુભવઃ** જ્યાં જમીન સંપાદનનો સમાવેશ થાય છે તેવા પ્રોજેક્ટ્સમાં વન્યજીવન મંજૂરી માટે સર્વેક્ષણ, જમીન રેકોર્ડ અપડેટ, રાજ્ય

**6) પસંદગીની પદ્ધતિ:** યોગ્યતાનો નિર્ણય નામાંકિત સ્ક્રીનીંગ સમિતિ દ્વારા લેવામાં આવશે. ઉમેદવારોને લાયકાત, અરજી સ્વીકારવા અથવ અસ્વીકાર કરવા વગેરે સંબંધિત તમામ બાબતોમાં પસંદગી સમિતિ / વહીવટનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે અને આ સંદર્ભમાં કોર્દ

(I) કરારના સમયગાળા દરમિયાન મહેનતાણું તરીકે એક નિશ્ચિત માસિક રકમ સ્વીકાર્ય રહેશે, જે નિવૃત્તિ સમયે લેવામાં આવેલા પગારમાંથી

(॥।) નિવાસસ્થાન અને કાર્યસ્થળ વચ્ચે મુસાફરીના हेतु માટે પરિવહન ભથ્થા તરીકે યોગ્ય અને નિશ્ચિત રકમ નિવૃત્તિ સમયે નિયુક્ત વ્યક્તિને લાગુ પડતા દરથી વધુ ન હોવાની મંજૂરી આપવામાં આવશે. નિમણૂકની મુદત દરમિયાન આ રીતે નક્કી કરાયેલ રકમ યથાવત રહેશે. જો કે

8) ફરીથી કાર્યરત નિવૃત્ત કર્મચારીઓએ રેલવે સાથે ગુપ્તતાના કરાર પર હસ્તાક્ષર કરવા પડશે જેમાં નૈતિકતા અને પ્રામાણિકતા પર કલમ

9) પસંદ કરાયેલા નિવૃત્ત કર્મચારીઓએ નિયુક્ત અધિકારીઓ પાસેથી યોગ્ય શ્રેણીની તબીબી યોગ્યતા માટે તબીબી તપાસ કરાવવી

11) ફરીથી કાર્યરત થવા માટે પસંદ કરાયેલા નિવૃત્ત કર્મચારીઓએ સમયાંતરે ફરીથી કાર્યરત થવાની યોજનાના તમામ નિયમો અને

12) ફરીથી કાર્યરત કર્મચારીઓને વહીવટીતંત્ર દ્વારા કોઈપણ કારણ આપ્યા વિના 15 દિવસની નોટિસ આપીને સેવામાંથી કાઢી/બંધ

15) હાલના નિયમો અનુસાર સૂચનામાં નિયમો અને શરતો/ખાલી જગ્યામાં કોઈપણ અનુગામી ફેરફારો માન્ય રહેશે. સિનિયર DEN (CO)

ADI અમદાવાદ પશ્ચિમ રેલ્વે/જ્યારે લાગુ પડે ત્યારે આ સૂચના હેઠળ પસંદગીમાં કોઈપણ અનુગામી ફેરફારો/સુધારણા/ઉમેરા/રદ કરવાને

16) જો અરજી/સેવા રેકોર્ડમાં કોઈ અનિયમિતતા/ખામી જણાય તો, પસંદગી પ્રક્રિયાના કોઈપણ તબક્<del>કે</del> કોઈપણ અરજદારની ઉમેદવારી

18) અરજી કેવી રીતે કરવી: ઉમેદવારે ખાલી જગ્યાની સૂચનાના પરિશિષ્ટ 'A'માં ઉપલબ્ધ નિયત અરજી ફોર્મેટમાં ભૌતિક ફોર્મ ભરવાનું

રહેશે અને નવીનતમ ફોટોગ્રાફ અને PPO ની નકલ સાથે સહાયક કર્મચારી અધિકારી-III, ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ, GCS

અમને લાઇક કરોઃ 🚹 facebook.com/WesternRly • અમને ફોલો કરોઃ 🔀 twitter.com/WesternRly

હોસ્પિટલ સામે, અમદુપુરા, અમદાવાદ, પિન કોડ-380025 ની ઓફિસમાં વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે.

રાજ્ય મહેસૂલ અધિકારીનો વિસ્તાર નંબર

1) કરારની તારીખથી 21.02.2026 સુધી પુનઃનિમણુક સંપૂર્ણપણે કરારના આધારે ઓફર કરવામાં આવશે.

. મૂળ પેન્શન બાદ કરીને પ્રાપ્ત થશે.કરારની મુદત માટે આ રીતે નક્કી કરાયેલ મહેનતાણુંની રકમ યથાવત રહેશે.

તેઓ નિવૃત્તિ સમયે તેમના હક મુજબ, જો કોઈ હોય તો, સત્તાવાર પ્રવાસ પર TA/DA માન્ય રાખી શકે છે. (iv) સેવા પૂર્ણ થયાના દરેક મહિના માટે દિવસના દરે ચૂકવેલ ગેરહાજરીની રજા મંજૂર કરી શકાય છે.

10) દૂર કરાયેલા/બરતરફ કરાયેલા/ફરજિયાત નિવૃત્ત કર્મચારીઓ ફરીથી કાર્યરત થવા માટે પાત્ર નથી.

13) જરૂરિયાત અને યોગ્યતાના સંદર્ભમાં દરેક કેસને કેસ ટુ કેસ જોવામાં આવશે.સમિતિનો નિર્ણય અંતિમ રહેશે.

17) કોઈપણ કાનૂની વિવાદ માટે,અધિકારક્ષેત્ર ફક્ત સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ,અમદાવાદ રહેશે.

14) આવી પુનઃનિમણકની મંજૂરી આપતા પહેલા પ્રામાણિકતા પાસાની તપાસ કરવામાં આવશે.

S/Dn Or Any other S/Dn. Of LALBAUG Division

नाभ जहस्यु

पिनाडीन सुरेन्द्र<u>डु</u>भार शाह

આથી જાહેર કરૂ છું કે, મેં મારૂ નામ

पिनाडीन सुरेन्द्रलाई शाह थी

બદલી **પિનાકીન સુરેન્દ્રકુમાર શાહ** રાખેલ છે. અને હવે પછી મારૂ નામ

**पिनाडीन सुरेन्द्रडुभार शाह** रहेशे.

જેની તમામે નોંઘ લેવી. સરનામુ:

૩, અવઘૂત નગર-ર સોસાચટી,

ભોલાવ, તા. જી. ભરૂચ ૩૯૨૦૦૧

Baroda O&M Circle, MGVCL

વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ

રિપોર્ટિંગ સમય

2) નિવૃત્ત રાજ્ય મહેસૂલ અધિકારીની આવશ્યકતા:

સરકારી એજન્સીઓ સાથે સંકલન સંબંધિત કાર્ય

7) મહેનતાણું, ભથ્થાં અને રજા:

શરતોનું કડક પાલન કરવું પડશે.

અધિકાર અનામત રાખે છે.

નકારવાનો અધિકાર પશ્ચિમ રેલવે અનામત રાખે છે.

પડશે.

કરી શકાય છે.

પૂછપરછ અથવા પત્રવ્યવહાર સ્વીકારવામાં આવશે નહીં.

વિસ્તાર

**3) વય મર્યાદા:** મહત્તમ 65 વર્ષ (મહત્તમ 64 વર્ષનો અરજદાર અરજી કરી શકે છે)

5) અરજદાર તે જ વિસ્તાર/જિલ્લામાંથી કામ કરે છે જ્યાં જગ્યા ખાલી હોય.

(II) કરારની મુદત દરમિયાન કોઈ વધારો,મોંઘવારી ભથ્થું અને HRA માન્ય રહેશે નહીં.

મંગાવવામાં આવે છે.

MGVCL

રાખેલ છે. તો આપ સૌ સભાસદોને જાણ સારૂ.

લાવવાની રહેશે.

MGVCL

(भेने४२श्री)

હોય ભાઈઓને કપારે કંકુ તિલક કરી તહેવાર ઉજવે છે. રક્ષાબંધનના મોઢું મીઠું કરાવી રાખડી બાંધે છે. અગાઉના દિવસે બજારમાં જોવા મળતી ત્યારે હાથમાં બંધાયેલ બહેનના રક્ષા અવનવી રાખડીઓ ખરીદવા બહેનો કવચ સામે ભાઈ જીવનભર રક્ષણનું દોડી આવતાં ભીડ જામી હતી.

કે મોસાર પક્ષ કે પછી માર્નીતી બહેન રાખડી બાંધી પવિત્ર રક્ષાબંધનનો

### ગોત્રી-સેવાસી રોક શાખા માટે ભાડાપક્રે જગ્યા મેળવવા માટે ટેન્ડર

**બેંક ઓફ બરોડા, બરોડા સિટી રિજન, ગોત્રી-સેવાસી રોડ શાખાના** પ્રસ્તાવિત મકાન માટે, ૨૦૦૦ થી ર૩૫૦ ચોરસ ફૂટના કાર્પેટ એરિયાવાળા ગ્રાઉન્ડ ફ્લોર પર, જગ્યાના માલિકો/પાવર ઓફ એટર્ની ધારકો પાસેથી ઓફર આમંત્રિત કરે છે. ગોત્રી સેવાસી રોડ અને સેવાસી કેનાલ રોડના જંકશનની નજીકમાં એક અગ્રણી સ્થાને, પ્રાધાન્થમાં ગોત્રી સેવાસી ટોડ પર સ્થિત જગ્યાઓ હોવી જોઈએ અને . તેમાં પૂરતી વીજળી સહિતની બધી સુવિધાઓ હોવી જોઈએ .

આ જગ્ગા ૧ મહિનાના અધ્યાસભાવના મહેલું. આ જગ્ગા ૧ મહિનાના સમયગાળામાં કબજા માટે તૈયાર હોવી જોઈએ અથવા કબજા માટે તૈયાર થવાની સંભાવના છે. ઇચ્છુક ઓફ્ર્રોએ તેમની ઓફ્ર્ર્ટ બે અલગ સીલબંધ કવરમાં **"ટેકનિકલ બિક**" **અને "ફાઇનાન્સિયલ બિડ**" ઉપર લખેલા કવરમાં, **રિજનલ હેડ, બેંક ઓફ બરોડા, બરોડા સિટી** શિજન, પમો માળ, સૂરજ પ્લાઝા III, સચાજીગંજ, વડોદરા ૩૯૦૦૦૫ ને ૩૦.૦૮.૨૦૨૫ ના રોજ અથવા તે પહેલાં બપોરે ૩:૦૦ વાગ્યા સુધી સબમિટ કરવાની રહેશે. જાહેર ક્ષેત્રના એકમો/સરકારી વિભાગોના મકાનોને પ્રાથમિકતા આપવામાં આવશે (વિગતો માટે ફૂપા કરીને અમારી વેબસાઇટ www.bankofbaroda.com ના ટેન્ડર વિભાગમાં લોગિન કરો ). બેંક કોઈપણ ઓફરને કારણ આપ્યા વિના સ્વીકારવા અથવા નકારવાનો અધિકાર અનામત રાખે છે.

DICABS

Ahmedabad,

Date: August 8, 2025

S.E. (O&M) Baroda

21.08.2025

### પશ્ચિમ રેલવે - રાજકોટ મંડળ

**Clerk and Peon** 

Experience in Basic Computer and

Banking Account Knowledge.

Application will be accepted before 12/08/2025 on

rmccbrc@gmail.com Contact: 84695 62655

<u>SLR/VP</u>ના ભાડાના કરાર માટે ઈ-હરાજી SLR/VP ના ભાડા' ના કરાર માટે ઈ-હરાજી આમંત્રિત કરવામાં આવી છે. કેટલોગ પહેલાથી જ IREPS વેબસાઇટ પર ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યું છે. વિગતો નીચે મુજબ આપવામાં

**કેટલોગ નંબરઃ** ઈ-SLR-RJT-૦૭-૨૫, તારીખઃ ૦૬/૦૮/૨૦૨૫

**કરારનો પ્રકારઃ** SLR/VP ભાડે આપવાનો

<mark>લોટ નંબરઃ ૧) 22717-SLR</mark>-F1,2)22960-SLR-R1, 3) 22905-SLR-R1 કરારનો સમયગાળો: ૦૨ વર્ષ

**લોટ શરૂ થવાની તારીખ અને સમયઃ** બધા લોટ માટે ઇ-હરાજી ૨૧-૦૮-૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શરૂ થશે.

ઉપરોક્ત કેટલોગમાં દર્શાવેલ લોટની વિગતો આગામી ઈ-ઓક્શન, ઝોનઃ પશ્ચિમ રેલવે, વિભાગ વાણિજિયક, રાજકોટ ડિવિઝન હેઠળ **www.ireps.gov.in** (ઈ - ઓક્શન લીઝિંગ)

અમને લાઇક કરોઃ 🚹 facebook.com/WesternRly • અમને ફોલો કરોઃ 🔀 twitter.com/WesternRly

## DIAMOND POWER **INFRASTRUCTURE LIMITED**

## **EXTRACT OF THE UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR** THE QUARTER ENDED ON JUNE 30, 2025

In compliance with Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") the Board of Directors of Diamond Power Infrastructure Limited ("Company") at their meeting held on Friday, August 8, 2025 approved the Unaudited Financial Results (Standalone and Consolidated) for the quarter ended June 30, 2025 ("Results")".

The results, along with the Limited Review Report (Standalone and Consolidated) by M/s Naresh and Co. Chartered Accountants, Statutory Auditors of the Company are available on the website of the Company at https://dicabs.com/investor/quarterly-results/ and websites of the Stock Exchanges, i.e. www.nseindia.com and www.bseindia.com respectively.

In compliance with Regulation 47 of the Listing Regulations, we hereby notify that the same can also be accessed by scanning the following Quick Response (QR) code:



For Diamond Power Infrastructure Limited

Samir Naik

Chief Financial Officer & Whole-time Director DIN: 11208141

Regd. Office: Phase II, Village Vadadala, Taluka - Savli, Vadodara - 391520 E-mail: cs@dicabs.com | www.dicabs.com | CIN: L31300GJ1992PLC018198

શ્રી દીપક મોહનભાઈ રોચલાણી

વડસર શાખા, જી.એફ. ૧૪–૧૭, પાર્ક પેરેડાઈઝ, બિલ્લાબોંગ સ્કુલ પાસે, વડસર રોડ, વડોદરા-૩૯૦ ૦૧૨, ફોન : +૯૧ -૦૨૬૫-૨૬૪૨૪૨૮ મો. : +૯૧ -૯૬૮૭૬ ૮૯૧૩૯ ઈમેલ : vadsar@bankofbaroda.com વેબ : www.bankofbaroda.in

દેવાદારને નોટીસ (સરફેસી કાયદા, ૨૦૦૨ની કલમ ૧૩ ની પેટા કલમ (૨) હેઠળ)

ફ્લેટ નંબર ૪૦૧ ગોલ્ડન રેસિડેન્સી, સંત કંવર કોલોની, બિલાશ હોલ પાસે, વારસિયા, ૩૯૦૦૦૬ વડોદરા. આદરણીય મહોદયા/મહોદય - સં. : અમારી વડસર સાથે ક્રેડિટ સુવિધાઓ બાબતે.

અમારા દ્વારા **તા. ૨૫.૦૧.૨૦૨૩**ના રોજ આપને પાઠવાયેલા પત્ર નંબર રિટેલ-૦૦૦૦૧૭૦૬૨૪૭-LMS હોમ લોન ક્રેડિટ સુવિધાઓ અને મંજૂરીની શરતો દર્શાવતા અમારા અનુમતિ પત્ર અનુસાર તમે ક્રેડિટ સુવિધાઓ મેળવવાનું અને તેળો અમલ કરવાનું શરૂ કર્યું હતું અને તે પૂરી પાડવા સામે તમોએ અહીં બાદમાં જણાવેલ મિલકતો અમારી પાસે ગીરવે મૂકી હતી. હાલમાં વિવિધ લોન/કેડિટ સુવિધાઓના ખાતામાં અને સિક્યોરિટી ફેડિટ્સનું

વ્યાજ ચૂક્વવાની તમારા જ જવાબદારા બન છ તે નારા મુજબ છ :										
	સુવિધાની પ્રકૃતિ અને પ્રકાર	મર્ચાદા રૂા. (લાખમાં)	વ્યાજનો દર	નોટિસની તારીખે બાકી (કરાર બાકી) (નોટિસની તારીખ સુધીના વ્યાજ સહિત)						
	હોમ લોન	રૂા. ૩૧.૫૦	વર્તમાન y oe.૪૫%	મુદ્દલઃ ૩૧,૧૫,૪૧७ ૧૦-૦૨- ૨૦૨૫ સુધી વ્યાજ (૦ દર ૦૯.७૦% વ્યાજ						

## સિક્યોરિટીઝના સંક્ષિપ્ત વર્ણન સાથે સિક્યોરિટી કરાર.

કોલોની જેમાં બ્લોક નં. ટી- પર રૂમ નં. ૪૯૦ જેમાં વડોદરા શહેર સર્વે કચેરીનો વિસ્તૃત વિસ્તાર નં. ૨, સિટી સર્વે નં. ૩૪૯૩ નોંધાયેલ છે અને તે વિસ્તાર મુજબ વહીવટ ૫૩૬ ,૬૬ .૬૯ ચોરસ મીટર અને બ્લોક નં. ટી- ૫૪ , રૂમ નં. ૪૯૧ જેમાં વડોદરા શહેર સર્વે કચેરીનો વિસ્તૃત વિસ્તાર નં. ૨ , સિટી સર્વે નં . ૩૪૯૪ નોંધાચેલ છે અને તે વિસ્તાર મુજબ આશરે ૪૫૫.૫૭.૬૨ ચોરસ મીટર , બંને મિલક્તો એક્બીજા સાથે જોડાયેલી છે , ઉપરોક્ત જમીનમ થોજના 'રાધેકૃષ્ણ હાઇટ્સ' ના નામ અને શેલીમાં રહેણાંક ફ્લેટ તરીકે ગોઠવવામાં આવી છે પરંતુ હવે ચોજનાનું નામ 'ગોલ્ડન રેસિડેન્સી' તરીકે કરવામાં આર્વ્યું છે જેમાં ચોથા માળે ફ્લેટ નં . ૪૦૧ , કાર્પેટ વિસ્તાર આશરે ૭૯ .૨૨ ચોરસ મીટર , બાલ્કની વિસ્તાર ૭ .૯૩ ચોરસ મીટર અને બાંધકામ વેસ્તાર ૮૭.૧૫ ચોરસ મીટર અને પ્રમાણસર અવિભાજિત જમીન વિસ્તાર ૪૪.૨૨ ચોરસ મીટર છે. ઉપરોક્ત મિલકત નીચે મુજબ સીમા ધરાવે છે: પૂર્વ- જોડાચેલ શહેર સર્વે નંબર ૩૪૯૫ ની મિલકત , પશ્ચિમ- કોમન , પેરોજ , સીડી અને ઓટીએસ , ઉત્તર- ઓટીએસ અને ફ્લેટ નંબર ૪૦૬ આ બાજ ુ. કોમન દિવાલ છે, દક્ષિણ- ઓટીએસ અને ફ્લેટ નંબર ૪૦૨ આ બાજુ કોમન દિવાલ છે.

(૧) તમે ૨૫.૦૧.૨૦૨૩ ના રોજ બેંક સાથે રૂા. ૩૧,૫૦,૦૦૦/- ની લોન સુવિધા માટે લોન કરાર કર્યો છે, જેમાં તમે સમાન માસિક હપ્તાઓ ( "EM" તરીકે ઓળખા છે) ચૂકવવા સંમત થયા છો. ઉપર જણાવેલ બાકી રકમમાં ૧૦.૦૨.૨૦૨૫ સુધીના વધુ ઉપાડ અને વ્યાજનો સમાવેશ થાય છે. (૨) જેમ તમે જણો છો , તમે ૧૦-૦૨ ૨૦૨૫ ના રોજ ઉપરોક્ત લોન/આઉટસ્ટેન્ડિંગ પર વ્યાજની ચુકવાશીમાં ડિફોલ્ટ કર્યો છે. તમે ૧૦-૦૯-૨૦૨૪ ના રોજ અને તે પછી ચુકવાશીના બાકી રહેલા ટર્મ લોનના હપ્તાઓની ચુકવણીમાં પણ ડિફોલ્ટ કર્યા છે. **(3)** તમારા દ્વારા કરવામાં આવેલા ડિફોલ્ટના પરિણામે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશો અને માર્ગદર્શિકા અનુસાર તમારા લોન ખાતાને ૦૯.૧૨.૨૦૨૪ ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અમારી વારંવાર વિનંતીઓ અને માંગણીઓ છતાં નથી. (૪) તમોને જે ક્રેડિટ સુવિધાઓ ત સિક્યોરિટીઝનો ઉપરોક્ત પ્રથમ ફકરામાં જણાવેલ છે અને તમારું ખાતું નોન-પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હોવાથી અમો આ નોટિસ દ सिड्योरिटाध्प्रेशन એन्ड झधनान्सियस એसेट्स એन्ड એन्डोर्समेन्ट ओड सिड्योरिटी छन्टरेस्ट એક्ट, २००२ना सेड्शन १३ना पेटा सेड्शन (२) अंतर्गत 416વી છે અને તમોને તમોને બેંકના લેણાં નીકળતા **રૂા. ૩૨,૬૯,૦૧૯/- (રૂપિયા બત્રીસ લાખ ઓગણસીત્તેર હજાર ઓગણીસ પુરા)** જે ઉપરોક્ત પ્રથમ ફકરા ઝનુસાર લેણાં નીકળે છે તે આ નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચૂકવીને તમારી જવાબદારી પૂર્ણ કરવાનું જણાવવામાં આવે છે. અમો તમોને એ પણ નોર્ટિસ પાઠવીએ છીએ કે બે ઉપરોક્ત ચૂકવણીની તારીખ સુધીમાં તમો વ્યાજ સહિતની રકમની ચૂકવણી નહીં કરો તો અમોને કથિત એક્ટના સેક્શન ૧૩ના પેટા સેક્શન (૪) હેઠળ અધિકાર મળે છે, જે અનુસાર અમે કોઇ પણ પગલું લેવા માટે મુક્ત છીએ તેની નોંધ લેવા વિનંતી. **(૫)** આ સાથે એ પણ નોંધ લેશો કે પ્રથમ ફકરામાં જણાવેલી કેડિટ સુવિધાઓ પરનું વ્યાજ તમો જ્યાં સુધી રકમની ચૂકવણી નહીં કરો ત્યાં સુધીનું દરેક સુવિધા માટે ચડતું રહેશે. (૬) કથિત એક્ટના પેટા સેક્શન ૧૩ અનુસાર અમો તમોને જાણ કરીએ છીએ કે તમો સિક્વોર્ડ મિલકતો જે ઉપરોક્ત પ્રથમ ફકરોમાં જણાવેલ છે, તેનું કોઇ પણ રીતે વેચાણ, ભાડે કે અન્ય કોઇ રીતે (સિવાય કે પોતાના વ્યવસાય) વિના ઉપયોગ અમારી આગોતરી મંજૂરી લીધા વિના કરી શક્શો નહીં. આ સાથે એ પણ જણાવવાનું કે કથિત એક્ટના તેક્શન ૧૩ના પેટા સેક્શન ૧૩ ની જોગવાઇ અનુસાર કોઇ પ્રકારનો ગુનો એક્ટના સેક્શન ૨૯ અનુસાર સજાને પાત્ર બને છે. **(७) અમો તમારું ધ્યાન દોરવા** માગીએ છીએ કે કથિત એક્ટના સેક્શન ૧૩નાં પેટા સેક્શન (૮) અનુસાર તમો તમામ લેણાંની રકમ, સાથે તમામ કિંમતો, ચાર્ઝુસ અને બેંક દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો હોય તેની સંપૂર્ણ ચૂકવણી કરીને જાહેર ઓક્શન/આમંત્રિત ક્વોટેશન્સ/દેન્ટર/ખાનગી પક્ષ માટેની તારીખના સમય પહેલાં સિક્યોર્ડ મિલક્તો **છોડાવી શકો છો. એ નોંધ લેશો કે ઉપરોક્ત નોટિસ પ્રકાશિત થયા પછી તમોને સિક્ચોર્ડ મિલકતો છોડાવવાનો અધિકાર મળશે નહીં. (૮)** આ ડિમાન્ડ નોટિસ્ કોઇ પ્રકારના પૂર્વગ્રહ વિના અને અન્ય કોઇ પણ અધિકાર કરાર અનુસાર લાગુ પાડ્યા વિના અથવા અન્ય કોઇ ઉપાય ન હોવાથી અમો તમને પાઠવીએ છીએ જેમાં અમારી લેણી નીકળતી રકમ પરત મેળવવાના અમારા અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સહી/- ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી, બેન્ક ઓફ બરોડા, વડોદરા

ઇ-મેઇલ : ajward@ucobank.co.in પરિશિષ્ટ - IV (રૂલ 8 (1)) હેઠળ

કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી નીચે સહી કરનાર યુકો બેંક, આજવા રોડ શાખા, અરૂણોદય કોમ્પલેક્ષ, દુધિશ્વર કોમ્પલેક્ષ પાસે, વડોદરા-390019ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશનુ એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, 2002 તથા સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, 2002ના નિયમ 3 સહિત કલમ 13(12) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. 09-05-2025ના રોજ કરજદાર શ્રી નિકુજ જયંતિલાલ બારોટ, સહ-કરજદાર શ્રીમતી ધ્રુવી નિકુજ બારોટ ને ડિમાન્ડ નોટિસ પાઠવી હતી. સદર નોટીસમાં પાઠવેલી રકમ રૂા.13,73,255.28 (રૂપિયા તેર લાખ તોત્તેર હજાર બુસો પંચાવન અને અહાવીસ પૈસા પૂરા) આ નોટીસ પ્રાપ્તીની

ારીખથી 60 દિવસની અંદર ચુકવી દેવાનું જણાવ્યું હતું. રજદાર મદરહુ રકમ પરત ચુકવામાં નિષ્ફળ જતા કરજદાર અને જાહેર જનતાને આ સાથે નોટિસ આપવામાં આવે છે કે સહી કરનારે સદરહુ ઓડીનેન્સ એક્ટની કલમ 13(4) અને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમ 2002ના નિયમ 8 સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહીં નીચે જણાવેલી મિલકતનો કબજો તા.08-08-2025નાદિવ્સે સંભાળી લીધેલ છે.

કરજદારઅને જાહેર જનતાને આથી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, તેમણે સદરહુ મિલકત તાબતમાં કોઈ વ્યવહાર કરવો નહીં અને કોઈપણ **યુકો બેંક, આજવા રોડ શાખા** માટે 31.13.73.255.28અને તેનાઉપર વ્યાજ.

ઃ સ્થાવર મિલકતનું વર્ણન ઃ

ક્લેટનું ઈક્વીટેબલ મોર્ટગેજ, માપ 900 ચો.ફુટ, રેવન્યુ સર્વે નં. 401, સિટી સર્વે નં. 855 અને પ્લોટ નં. A/174 થી 181, "હરીસાંઈ શરનમ" એપાર્ટમેન્ટ નામે જાણીતી સ્ક્રીમ, ટાવર-A, ફ્લેટ નં. 505, પાંચમો માળ, વિભાગ-2 ખાતે સ્થિત, દંતેશ્વર, વડોદરા, કિસ્ટ્રી. અને સબ ડિસ્ટ્રી. વડોદરા SRO વડોદરા-2 (દંતેશ્વર) ખાતે નોંધાયેલ. જે મિલકર્તની ચતુર્સિમા : પૂર્વ : ટાવર-B, પશ્ચિમ : ફ્લેટ નં

506, ઉત્તર: દર્શનમ બંગલો, દક્ષિણ: ફ્લેટ નં. 504. અધિકૃત અધિકારી, યુકો બેંક. તા. 08-08-2025 | સ્થળ : વડોદરા.

## DIAMOND POWER INFRASTRUCTURE LIMITED

INFORMATION REGARDING 33<sup>RD</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY TO BE HELD THROUGH VIDEO **CONFERENCING/OTHER AUDIO VISUAL MEANS** 

### **ANNUAL GENERAL MEETING**

- Shareholders may note that the 33<sup>rd</sup> Annual General Meeting ('AGM') of the Company will be held through video conferencing and other audio visual means ('VC/OACM') on Friday, September 26, 2025 at 11:30 A.M. (IST) in compliance with all the applicable provisions of the Companies Act. 2013 and the rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations') read with all the applicable circulars on the matter issued by the Ministry of Corporate Affairs ('MCA') and the Securities and Exchange Board of India ('SEBI'), to transact the business set out in the Notice calling the AGM.
- 2. In compliance with the above, an electronic copy of the Notice of the AGM and Annual Report for Financial Year 2024-25 will be sent to all the shareholders whose email IDS are registered with the K-Fin Technologies Limited / Depositories. Additionally, pursuant to Regulation 36(1)(b) of the SEBI Listing Regulations, a letter will be sent to the Shareholders whose e-mail addresses are not registered, providing the web-link of Company's website, including the exact path, where complete details of the Annual Report for FY 2024-25 can be accessed. The Company shall send the physical copy of the Annual Report for FY 2024-25 only to those shareholders who specifically request for the same at cs@dicabs.com by mentioning their DP ID & Client ID or Folio No., wherever applicable.
- . The Notice of 33<sup>rd</sup> AGM and the Annual Report for the Financial Year 2024-25 will also be made available on the Company's website, at www.dicabs.com and on the websites of the stock exchanges at www.bseindia.com and www.nseindia.com.

### REGISTRATION/UPDATION OF EMAIL IDS

4. Shareholders who wish to register/update their email ID are requested to follow the below instructions:

For shares in Physical Mode: Register/update the details with the Company's RTA by sending KYC Documents in the prescribed Form ISR-1 and other relevant forms, which is available on the Company's website at https://dicabs.com/investor/shareholders-information/ and submit the same to K-Fin Technologies Limited at Selenium Building, Tower-B, Plot No 31 & 32,Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad, Rangareddy, Telangana, India - 500 032 along with the documents mentioned in

For shares in Electronic mode: Register/update the details in your demat account as per the process advised by Depository Participant(s).

### **VOTING INFORMATION**

- Members can attend and participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. The Company will provide its Members, the facility of remote e-voting through electronic voting services arranged by K-Fin Technologies Limited, Registrar and Transfer Agent (RTA). Electronic voting shall also be made available to the Members participating in the AGM. In terms of SEBI Circular no. SEBI/HO/CFD/CMD/CIR/P/2020/242 dated 9th December 2020, evoting process will also be enabled for all 'individual demat account holders', by way of a single login credential, through their demat accounts / websites of National Securities Depository Limited ('NSDL') and / or Central Depository Services (India) Limited ('CDSL') or Depository Participant(s).
- Shareholders who have not registered their email addresses will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through remote e-voting or through e-voting system during the AGM. The manner of voting remotely for shareholders holding shares in dematerialized and physical mode will be provided in the Notice of AGM.
- The cut-off date for determining the eligibility to vote by remote evoting or by e-voting system at the AGM shall be Friday, September

13, 2023. The remote e voting details are as ander.						
Remote e-voting start date and time	Monday, September 22, 2025 09:00 A.M.(IST)					
Remote e-voting end date and time	Thursday, September 25, 2025 05:00 P.M. (IST)					

8. The above information is being issued for the information and benefit of all shareholders of the Company and is in compliance with the applicable MCA and SEBI Circular(s).

> For Diamond Power Infrastructure Limited Diksha Sharma - Company Secretary Membership No.: 56317

Ahmedabad 08th August, 2025

Regd. Office: Phase II, Village Vadadala, Taluka - Savli, Vadodara - 391520

E-mail: cs@dicabs.com | www.dicabs.com | CIN: L31300GJ1992PLC018198



તારીખ : ૧૦.૦૨.૨૦૨૫, સ્થળ : વડોદરા

# **BANCO PRODUCTS (INDIA) LIMITED**

Regd. Office: Bil, Near Bhaili Rly. Station, Padra Road, Dist. Vadodara - 391 410. Tel. No.: (0265) 2318226 CIN NO:- L51100GJ1961PLC001039, Website:-www.bancoindia.com, E-mail:-investor@bancoindia.com

## EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2025

	Standalone					Consolidated				
Particulars	Quarter ended 30.06.2025 (Unaudited)	Quarter ended 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2024 (Unaudited)	Year ended 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2025 (Unaudited)	Quarter ended 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2024 (Unaudited)	Year ended 31.03.2025 (Audited)		
Total income from Operations	31,238	41,028	25,812	124,902	98,385	89,344	80,597	325,554		
Net profit /(loss) for the period ( before tax, exceptional and/or extra ordinary items)	6,372	15,201	3,753	31,121	16,425	18,967	10,851	53,421		
Net profit /(loss) for the period before tax (after exceptional and/or extra ordinary items)	6,372	15,201	3,753	31,121	16,425	18,967	10,851	53,421		
Net profit /(loss) for the period after tax (after exceptional and/or extra ordinary items)	4,790	13,733	2,779	26,626	10,952	15,350	6,867	39,180		
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	4,790	13,677	2,779	26,570	16,406	14,727	8,484	40,867		
Equity Share Capital	2,861	2,861	1,430	2,861	2,861	2,861	1,430	2,861		
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	Rs.8	Rs.82,144/-Lakhs as on 31st March 2025			Rs.1,27,368/- Lakhs as on 31st March 2025			h 2025		
Earning per share (of Rs. 2 /- each) ( for continuing and discontinued operations)										
Basic	3.35	9.60	1.94	18.61	7.66	10.73	4.80	27.39		
Diluted	3.35	9.60	1.94	18.61	7.66	10.73	4.80	27.39		

Note: (1) The above is an extract of the detailed format of the Unaudited Financial Results of the Company for the Quarter ended 30th June, 2025 filed with the Stock Exchange under  $Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) \ Regulations, 2015. The full format of the Quarter ended 30th June, 2025 are available on the website of the Quarter ended 30th June, 2025 are available on the website of the Quarter ended 30th June, 2025 are available on the website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Website of the Quarter ended 30th June, 2025 are available on the Quarter ended 30th June, 2025 are available on the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Quarter ended 30th June, 2025 are available of the Q$ BSE Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company at www.bancoindia.com. (2) The above results (Standalone and Consolidated) have been prepared in accordance with Indian Accounting Standards ('IND AS) notified under section 133 of the companies Act 2013, read together with relevant rules is sued there under and other accounting principles generally accepted in India. During the year 2024-25, 7,15,18,650 equity shares of Face Value of Rs.2/- were allotted to the eligible holders of equity shares on the record date (i.e. 30.12.2024) as bonus equity shares by Capitalizing Securities Premium Rs.1200.31 Lakhs and General Reserve Rs. 230.06 Lakhs. In accordance with the 'Ind AS 33 - Earning per share', the figures of Earning Per Share for the period June'24 has been restated to give effect to the allotment of the bonus shares.

For Banco Products (India) Limited (Mehul K Patel) Chairman

Place: Vadodara

Date: 08.08.2025

### કચ્છ કૉર્પોરેટ ફોરમના ઉપક્રમે પરિસંવાદ

## સમયમાં રોકાણ કરો, જોખમ ખેડો, અંતરાય વટાવો અને સખત પરિશ્રમ કરો : પ્રોફેસર ઉદય સાળુંખે

## વાર જૈન મુનિનો બસ્સો અવધાનનો પ્રયોગ કોઈપણ ક્રમમાં જવાબ આપશે

બમારા પ્રતિનિધિ તરફથી મંબઈ, તા. ૮: આપણા ધર્મમાં ુ ૧૦, ૧૧. ૦. - ૧. ૧૧. ધ્યાનનું અનેરું મહત્ત્વ છે. ધ્યાન થકી અધ્યાત્મની ઊંચાઈએ પહોંચી શકાય છે. જૈનાચાર્ય પૂ. આચાર્ય શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના સાક્ષિધ્ય અને પૂ. આ. સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી

મ.સા.ના શિષ્ય અને એક વખત મુંબઈમાં શતાવધાનનો સફળ પ્રયોગ કરનારા ડૉ. મુનિ શ્રી વૈરાગ્યયંદ્ર સાગરજી મ.સા. રવિવારે સવારે આઠ વાગ્યે ભગવાન શિવની નગરી



ભગવાન શિવની નગરી ઉજજૈનમાં પહેલી

ડૉ. મુનિ શ્રી વૈરાગ્યચંદ્ર સાગરજી મ.સા.

१९०९ नमां अञ्चो अवधाननो

ઉજ્જૈનના ગંગાઘાટ પર આવેલા મૌની બાબાના આશ્રમમાં ત્રણેક હજાર લોકોની હાજરીમાં સાગરાનંદસૂરી મહારાજસાહેબ રચિત ગુંથો પર મુંબઇ યુનિવર્સિટીમાં પીએચડી કરનારા માસા: વાવવાવવવવ સર ૨૦૦ સવાલના જવાબ તેમની આત્મશક્તિને આધારે આાપશે. તેઓ ક્રમબદ્ધ જ નહીં કોઈપણ સવાલનો જવાબ એના ક્રમ સાથે .... ઉજ્જૈનના શ્રી આદિશ્વર ચંદ્રપ્રભુ જૈન મૂ.પૂ.ચા.થુ.પા ટ્રસ્ટ, શ્રી માણિભદ્ર યક્ષરાજ તીર્થધામ અને આગમોદ્ધારક ચાતુર્માસ સમિતિ દ્વારા આયોજિત બસ્સો

મ.સાં. વિવિધ વિષય પર ૨૦૦

શતાવધાનમાં માઇન્ડ પવાર શરીરની શ્રેષ્ઠ શક્તિ છે, આત્મા અનંત શક્તિમાન છે. ધ્યાન અનુભૂતિનો પ્રવેશદ્વાર છે એને પ્રત્યક્ષ અનભવ થશે. બહિનો કેવી રીતે વિકાસ થાય, માઇન્ડ પવાર કેવી રીતે વિકસે એની ટિપ આપવામાં આવશે.

મુંબઈ, તા. ૮ : ''તમારે આગળ વધવું હોય તો સતત વૃદ્ધિ ઉપર લક્ષ્ય રાખવાનું છે. વૃદ્ધિ અગત્યની છે. બુદ્ધિ પ્રતિભાને આકર્ષવા છે. ગુહ જાતભાગ આડવવા ઉપરાંત તેમાં રોકાણ પણ જરૂરી છે'', એમ વી સ્કૂલના ગ્રુપ ડાયરેક્ટર પ્રો. ડૉ. ઉદય સાળુંખેએ કચ્છ કૉર્પોરેટ ફોરમના ઉપક્રમે યોજાએલા ''૧૦ × ગ્રોથ' પરિસંવાદમાં ઉદ્**ઘાટન** પ્રવચન આપતાં જણાવ્યું હતું. વિશ્વમાં કંઈ શીખવા સમયમાં

અમારા પ્રતિનિધિ તરફથી

રોકાણ કરો. જોખમ ખેડો, અંતરાય રાત્રણ કરા. જાખન ખાદ, અસરાપ વટાવો અને સખત પરિશ્રમ કરો, એમ સાળુંખેએ જણાવ્યું હતું. અનિશ્ચિતતાનો સામનો કઇ રીતે કરો છો તે અગત્યનું છે એમ

કહી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર રેપ ટકા જકાત લાદવામાં આવી છે એ પડકારને તમે કઇ રીતે ઝીલી લો છો તે મહત્ત્વનું છે. શારીરિક અને માનસિક સક્ક્રતા

સાથો સાથ નાણાકીય સક્કતા પણ એટલી જ આવશ્યક છે, એમ તેમણે જણાવ્યું હતું. ગો ઝીરોના સ્થાપક કિરણ

શાહે પરિવારના બિઝનેસથી

કરે છે તે બાબતે ધ્યાન આપવું આવશ્યક છે. કોઇપણ બિઝનેસમાં ઘણા હરીફો રહેવાના પરંતુ તે સામે માર્કેટિંગ વ્યૂહસ્ચના અગત્યની છે.

અને સીઇઓ રોણિતા મિત્રા, ઇનક્લએન્સિવ ડોટ આઇઓના સહ-સ્થાપક ઇશિકા ભાર્ગવ અને ભાલિટયા

મેટલ કાફ્ટના મૅનેજિંગ પાર્ટનર હિતેન્દ્ર ભાવરિયાએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રોફિટ

વ્હિલના સહ-રથાપક વિવેક ભાગીવે (તસવીરમાં ડાબેથી પહેલા) કર્યું હતું

અલગ થઇને નવો બિઝનેસ શરૂ

કરવા સુધીની પોતાની બિઝનેસ યાત્રાનો સુપેરે પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારે

લાખ્ખો રૂપિયાના પગારની નોકરી છોડીને બિઝનેસમાં આગળ વધવું

હતું અને તે કારણે પરિવારના બિઝનેસમાં જોડાયો હતો. ધીમે

ધીમે કરતા ૨૦૨૦ના વર્ષમાં

મુંબઇમાં ૧૦૪મો સ્ટોર

તેમણે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં માર્કેટિંગ સવિશેષ

અગત્યનું છે. આજે માર્કેટિંગનો ખર્ચપણ વધ્યો છે. જોકે,

ગ્રાહકો કયા પોડક્ટની ખરીદી

સ્થાપ્યો હતો.

''અસરકારક માર્કેટિંગ દ્વારા દસગણી વૃદ્ધિ'' વિષયે આયેજિત પથમ સત્રમાં ગાલા પિસાઇસ એન્જિનિયરિંગના એમડી કિરીટ ગાલાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં માનસિકતામાં ફેરફાર કરી વિકાસ સાધવાનો છે.

કોઇપણ કામ હાથ ઉપર ધરો તો તે ઉત્તમ ગુણવત્તા ધરાવતું હોવું જોઇએ. સખત પરિશ્રમ આવશ્યક છે પરંતુ સફળતાનો કોઇ અંત નથી. આ સાથોસાથ બિઝનેસ માટે અમુક આદર્શ હો વા જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. પ્રથમ સત્ર બાદ યોજાએલી ચર્ચામાં બ્રાન્ડ ઇગલ કન્સલટિંગના

સ્થાપક અને સીઇઓ રોણિતા મિત્રા, ઇનફલુએન્સિવ ડોટ આઇઓના સહ-સ્થાપક ઇશિકા ભાર્ગવ અને ભાલરિયા મેટલ ક્રાફ્ટના મૅનેજિંગ પાર્ટનર હિતેન્દ્ર ભાલરિયાએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રોફિટ વ્હિલના સહ-સ્થાપક વિવેક ભાગવે કર્યું હતું.

વ્યૂહસ્થના દ્વારા દસગણી વૃદ્ધિ વિષયે આયોજિત દ્વિતીય સત્રમાં ઇવાય પાર્થેનોનના પાર્ટનર શિશિર

આંખોની શસ્ત્રક્રિયા કરાવનારો ૭૧

વર્ષનો વૃદ્ધ કોઈને આંખ મારી શકે?

માંકડે અભ્યાસપર્ણ વક્તવ્ય આપ્યં હતું. ત્યારબાદ ચર્ચાસત્રમાં નિટકો લિમિટેડના પ્રેસિડેન્ટ ઑપરેશન્સ દિવ્યાંગ છેડા, સ્પેક્ટ્રમ ઇમ્પેક્ટના સસ્ટેનિબિલિટી ઇન્વેસ્ટર મિરિક સસ્ટાનાબાલટા ઇન્વસ્ટર ામારક ગોગરી, ટાઇમ્સ ઑફ ઇંડિયા શુપના શુપ કૉર્પોરેટ ડાયરેક્ટર રાકેશ સો ની અને ઇવાય પાર્થેનોનના પાર્ટનર શિશિર માંકડે ચર્ચામાં ભાગ લીધો હતો

ત્રીજા સત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટ્રાન્સફોર્મેટિવ મારફત દસગણી વૃદ્ધિ વિશે કેર લેબ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને પ્રાઇવેટ લામેટરના સ્થાપક અને સીઇઓ દેવે શ રાજ્ય ધ્યક્ષે અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. ત્યારભાદ ચર્ચાસત્રમાં એઆઇ કન્સલિટિંગ વર્લ્ડ વાઇડ ટેક્નોલોજીના ડાયરેક્ટર અને હેડ અજય દિચિર, કેર લેબ્સ પ્રાઇવેટ બ્લિપ્ટેલ્ના આપદ અને ચીઇઓ લિમિટેડના સ્થાપક અને સીઇઓ દેવેશ રાજાધ્યક્ષ, માર્ટેક ઍન્ડ એઆઇ – પર્ફોર્મિક્સ ૦ પબ્લિક ગ્રુપ્સના હેડ સૌરભ આર્ય અને રુબિકોન્ રિસર્ચ લિમિટેડના સુમંત ું પીગાંવકરે ભાગ લાધો હતો. આ ચર્ચાસત્રનું સંચાલન સિગ્નલ વેન્ચર્સના સહ-સ્થાપક અને

### ઉદ્ભવસેના અને મનસેના બે નેતાઓ બાખડ્યા નાસિકમાં શિવસેના (ઠાકરે)

### રાજકીય સમજૂતીની ચર્ચા ચાલુ છે ત્યારે આ ઘટના બની

અમારા પ્રતિનિધિ તરફથી મુંબઈ, તા. ૮ : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચંટણીઓ આગામી ત્રણથી ચાર મોસમાં યોજાવાની છે. તેમાં शिवसेना (ठाइरे)ना वडा ઉद्धव ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે એ બે પિતરાઈ ભાઈએ રાજકીય સમજૂતી કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે નાસિકમાં શિવસેના (ઠાકરે) અને મનસેના ને તાઓ વચ્ચેની બેઠકમાં મારામારી થઈ હતી. તેની ચર્ચા

અને મનસેના નેતાઓની આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાસિકના રસ્તા પરના ખાડા, વધતી જતી ગુનાખોરી, અનિયમિત પાણીપુરવઠો અને ખેડૂતોના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી રહી હતી. આ બેઠકમાં શિવસેના (ઠાકરે)ના આગેવાન જયંત દિંડે બોલવા ઊભા થયા હતા.

યા હતા. પોતાના ભાષણના અંતે તેમણે વિધાનસભાની ચૂંટણી અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. નાસિક મધ્યની બેઠકમાં વસંત ગીતેનો પરાભવ થયો હતો. દિડેએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન આપણે એમ.ડી. ડ્રગ્સ અને અન્ય મુદ્દા યોગ્યરીતે હાથ ધર્યા હોત તો અને અમુક આપણે ચૂંટણી જીતી ગયા હોત. તે સમયે વસંત ગીતેના નિકટના મિત્ર અને નાસિકના ભૂતપૂર્વ મેયર વિનાયક પાંડે ઊભ યુરા હતા. તેનું કારણ ચૂંટણીની વ્યૂહરચના ગીતે અને પડિએ ઘડી હતી. પડિએ પૂછ્યું હતું કે, જેડ ૪૦ વર્ષ સુધી આપણે લડ ચલાવતા હતા તો તે સમયગાળામાં આપણે શું કર્યું? પાંડેના પ્રશ્ન પછી જયંત દિડેએ આખા પ્રકરણ ઉપર પડદો

દિલગીરી પણ વ્યક્ત કરી હતી

જોકે, નારાજ થયેલા વિનાયક પાંડે કાર્યાલયમાંથી બહાર નીકળી ગયા

## હતા. આ વિવાદની નાસિકમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. બુલેટ ટ્રેનના માર્ગ પર ધ્વનિ અવરોધક

મુંબઈ, તા. ૮ : ધ્વનિપ્રદૂષણ બુલેટ ટ્રેન રૂટ પર અત્યાર સુધી ટાળવા માટે બુલેટ ટ્રેનના માર્ગ ૩૯૨ કિ.મી. ઘાટ બાંધકામ, પર ધ્વનિ અવરોધક બેસાડવામાં ૩૨૯ કિ.મી. ગર્ડર ક્રાસ્ટિંગ અને આવ્યા છે. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેનના ૫૦૮ કિ.મી.માંથી વેં ૮૮ ેકિ.મી.ના ભાગમાં શિંકાન્સેન ટૅક્નોલોજીના ઉપયોગથી ૩.૭૭ લાખ ધ્વનિ

૩૦૮ કિ.મી.ના માર્ગ પર ગર્ડર ઊભા કરવાનું કામ પૂર્ણ થયું છે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી થાણે દરમિયાન અને થાણે ખાડીની નીચેથી પસાર થનારી ટનલનું કામ શરૂ થયું છે. બુલેટ ટ્રેન ડુંગરાળ વિસ્તાર, ખાડી વિસ્તાર અને રહેવાસી વિસ્તારમાંથી પસારથવાની છે. ഉള്പരി രൂപാല്മി വേദ થતી વખતે ભારે ધ્વનિ પ્રદૂષણ થવાની શક્યતા છે. ખાસ કરીને રેલવેના પાટા સાથે ઘર્ષણથી થનારા કર્કશ અવાજથી આરોગ્ય

### મુંબઈ, તા. ૮ (પીટીઆઈ): ઈલોસ ગુકામાં હિન્દુ, જેન અને મહારાષ્ટ્રના છત્રપતિ બોહ ધર્મની ગુકાઓનો સમૃદ્ધ સંભાજીનગરમાં આવેલી યુનેસ્ક્રી છે. તાજેતરમાં જેન ગુકા સંકુલમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ ઈલોસાની ઈન્દ્ર સભા તરીકે ઓળખાતી ગુકા નુખરુ, તા. ટ (પાટાબાઇ) . મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ઈલોરાની ગુકામાં પાણી લીંકેજને રોકવા માટે નંબર ૩૨માં ઝરણું વહેતું હોવાનું ુત્તર પાર્ડું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું તિરાડોનું સમારકામ અને ગટરોની સફાઈનું કામ હાથ ધરશે. વૈશ્વિક જાણવા મળ્યું હતું. નિષ્ણાતોના મતે પાણીના ટપકવાથી પ્રાચીન ધરોહરમાં સ્થાન ધરાવતી આ ગુફામાં નવમી સદીના ભીંતચિત્રોની નજીક ઝરણાંઓમાંથી પાણી ટપકતું હોવાથી સમારકામ કરાશે.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ

ઈલોરા ગુફામાં સમારકામ કરાશે

છત્રપતિ સંભાજીનગરથી લગભગ ૩૦ કિમી દૂર આવેલી

ચિત્રોને નુકસાન થઈ શકે છે. આ ગુફામાં મંદિર, ઉત્કૃષ્ટ શિલ્પો અને ભીતિચિત્રો છે. ગુરું સંકુલની ઉપર એક કોંક્રિટ ડ્રેઇન છે, જ્યાં પાણીનો પ્રવાહ સુગમ રહે એ માટે કાદવ કાઢવાની તેમ જ નાની તિરાડોને ભરવાની જરૂર છે.

### રૂા. સાડા છ લાખના બે ટન ગુટકા-પાન-મસાલા જપ્ત

મુંબઈ, તા. ૮ : રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના જવાનોએ ગત શનિવારે દાદર રેલવે સ્ટેશન પર બલિયા-દાદર એક્સ્પ્રેસમાંથી આશરે બે ટન ગુટકા અને પાન-મસાલા જપ્ત કર્યા છે. જપ્ત કરેલા માલની કિંમત અંદાજે સાડાછ અજાણી વ્યક્તિ સામે કેસ નોંધીને

BANGO

વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

.... આરપીએફ પાસેથી મળેલી માહિતી મુજબ શનિવારે સવારે ૭.૪૫ વાગ્યે આ ટ્રેન દાદર સ્ટેશન ૫૨ આવ્યા બાદ પાર્સલ કર્મચારી ઉદય ખરેની દેખરેખ હેઠળ બે પાર્સલ પ્લેટફોર્મ નંબર ૧૩ અને ૧૪ ઉપર ઉતારવામાં આવ્યા હતા.

### જાતીય સતામણીના કેસમાં કોર્ટે મુક્ત કર્યો મુંબઈ, તા. ૮ ઃ બન્ને આંખની





ન્યાયાધીશ સત્યનારાયણ આર. માવંદરે જણાવ્યું હતું. આરોપી હવે જેની ઉંમર ૭૮ વર્ષ છે તે જામીન

ન્યાયાઘીશને એ પણ અજગતું લાગ્યું હતું કે, બિલ્ડિંગના અન્ય કોઈએ આવી ગેરવર્તણૂક જોઈ નહતી. આરોપીએ છોકરીને જોઈને કદાચ કેટલાક શબ્દો ઉચ્ચાર્યા હશે જે તેના ઈરાદાને દર્શાવે છે, પણ ફરિયાદ પક્ષ પાસે આવી કોઈ વિગત નથી. છોકરીની માતા પણ અવું કહેતી નથી કે તેણે આરોપીને તેની પુત્રી સાથે કોઈપણ સમયે

ગેરવર્તણક કરતો જોયો હતો. એમ ગરવતલૂરુ ઝડા-ન્યાયાધીશે જણાવ્યું હતું. આ કેસ ૭ સપ્ટેમ્બર, -ેંબાઇ દર્ત

૨૦૧૮ના નોંધાયેલી એફઆઈઆરથી ઉદ્દભવ્યો હતો. નોંધાયેલી નવ વર્ષની બાળકીએ ફરિયાદ કરી હતી કે, આરોપી તેને આંખ મારતો હતો અને અભદ્ર હરકતો કરતો હતો. જોકે, ન્યાયાધીશે ફરિયાદ પક્ષના કેસમાં ઘણી વિસંગતતાઓ નોંધી હતી. ફરિયાદ પક્ષના પુરાવા શંકાના દાયરામાં આવે છે. આમ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

## 'છાવા રાઇડ' ઍપ દ્વારા મહારાષ્ટ્ર નવો ચીલો ચાતરશે

ઑલા-ઉબેર જેવી કંપનીઓને સીધી ટક્કર : ટૅક્સી, રિક્ષા અને બસ બધા માટે એક જ ઍપ

### ઉમેશ દેશપાંડે તરફથી

મુંબઈ, તા. ૮ ઃ રિક્ષા કે ટેક્સી બુક કરવા માટે લોકો બહુ જ સરળતાથી 'ઓલા' કે 'ઉબેર'નો ઉપયોગ કરતા હોય છે. આવી ઍપ સંચાલકોને એગ્રેગટરો કહેવાય છે. જેમની આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી મોનોપોલી છે. મહારાષ્ટ સ્ટેટ રોડ ટાન્સપોર્ટ વધાવા માનાપાલા છે. મહારાષ્ટ્ર સ્ટટ રાડ ડ્રાન્સપાય કોર્પોરેશન (એમએસઆરટીસી) 'છાવા રાઇડ' નામથી કેન્દ્ર સરકારના એગ્રીગેટરો માટે બનાવેલા નિયમ મુજબની એપ તૈયાર કરી રહી છે. જે ઓલા અને ઉબેરને ટક્કર્ આપશે. આ નવી ઍપ ટેક્સી તથા રિક્ષા ડ્રાઇવરોને સારી આવક તથા નાગરિકોને સુરક્ષિત અને વિશ્વનીય મુસાફરી પૂરી પાડશે. 'ઓલા' કે 'ઉબર' માત્ર રિક્ષા કે ટેક્સી બુક કરવા માટે જ ઉપયોગમાં લેવાય છે. જયારે 'છાવા'ની મદદથી રિક્ષા, ટેક્સી ઉપરાંત બસ તથા ઇલેક્ટ્રિક બસોની ટિકિટનું બુકિંગ પણ કરી શકાશે. આમ વિવિધ પ્રકારના ટ્રાન્સપોર્ટની સુવિધા એક જ

### છત્રપતિનું નામ

રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકના મતે એમએસઆરટીસી સંચાલિત આ ઍપ નિગમ માટે નવી વધારાની આવકનું સાધન બનશે. છત્રપતિ સંભાજી મહારાજને છાવા એટલે કે સિંહબાળ તરીકે ઓળખવામાં આવતા. તેથી 'જય મહારાષ્ટ્ર', 'મહા-રાઇડ', 'મહા-યાત્રી' અને 'મહા-ગો' જેવા નામો કરતા આ નામને મુખ્ય પ્રધાન તથા નાયબ મુખ્ય પ્રધાનોએ આ અંગે મળેલી બેઠકમાં પ્રાધાન્ય અપવામાં આવ્યું હતું. ખાનગી ઍપ મોટા પ્રમાણમાં કમિશન લે છે. 'છાવા' ઍપને કારણે ડ્રાઇવર તથા પ્રવાસી બક્ષેને લાભ થશે. વળી મુંબઈ બૅન્ક મહારાષ્ટ્રના યુવકોને વાહનોની ખરીદી કરવા માટે ૧૦ ટકાના વ્યાજ દરથી લોન પણ આપશે. વિવિધ સરકારી યોજના અંતર્ગત ૧૧ ટકા સબસિડી



આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ મહારાષ્ટ્રના યુવાનોને શૂન્ય ટકા વ્યાજ દરે વાહન ખરીદવા માટે લોન આપશે

### ઇજારાશાહીને તોડવાનો પ્રયત

કેન્દ્ર સરકાર પણ 'ઓલા' કે 'ઉબેર' જેવી કંપનીઓની ઇજારાશાહી તોડવા માટેનો પ્રયત્ન કરી રહી છે. જેમાં 'સહકાર ટેક્સી' નામની યોજના છે. જે ખાનગી એગ્રગેટરો સાથે સ્પર્ધા કરશે. તેમ જ ડાઇવરોને વધુ વળતર આપવાનો પ્રયાસ કરશે. દેશની વિવિધ સહકારી સંસ્થાઓ સાથે મળી 'ભારત ટેક્સી' નામક પ્લેટફોર્મ વિકસાવી રહ્યાં છે. જે રાષ્ટ્રીય સ્તરે ટેક્સી સેવાઓ આપવાનો પ્રયાસ કરશે. કેટલાંક રાજ્યોમાં સરકાર દ્વારા બસ બુકિંગ માટે એપ શરૂ કરાઈ છે. જેમકે 'જીએસઆરટીસી ગુજરાત, 'એપીએસઆરટીસી' આંધ્ર પ્રદેશ, 'ટીએસઆરટીસી' તેલંગણ તેમ જ ખાનગી ક્ષેત્રે

### જાહેર પરિવહનને પ્રોત્સાહન

મહારાષ્ટ્ર સરકારની 'છાવા' એપ એક પ્રથમ પહેલ છે. જેમાં ખાનગી ક્ષેત્ર સાથે સરકારના નિયંત્રણવાળી સંસ્થાની સીધી સ્પર્ધા હશે. પાઇવેટ એપ ઘણી વખત છૂપા ચાર્જલેતી હોય છે. તેમ જ ગ્રાહકોને વિવિધ યોજનાના નામે લૂંટવામાં આવતા હોય છે. 'છાવા' એપમાં આવો કોઈ પણ પ્રકારનો છૂપો ચાર્જ નહી રાખવામાં આવે. તેથી મુસાફરો માટે પણ આ ઍપ ફાયદાકારક રહશે. વળી 'છાવા' ને કારણે જાહેર પરિવહનને પણ પ્રોત્સાહન મળશે. ઓલા તથા ઉબેરની જેમ આ ઍપમાં પણ વાહન હાલ કયા સ્થળે છે એ જાણી શકાશે. તેમ જ ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ હશે.

### **BANCO PRODUCTS (INDIA) LIMITED**

Regd. Office: Bil, Near Bhaili Rly. Station, Padra Road, Dist. Vadodara - 391 410. Tel. No.: (0265) 2318226 CIN NO:- L51100GJ1961PLC001039, Website: -www.bancoindia.com, E-mail:-investor@bancoindia.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2025

ખોટી ધારણા છે. એમ ખાસ

	Standalone				Conso	lidated		
Particulars	Quarter ended 30.06.2025 (Unaudited)	Quarter ended 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2024 (Unaudited)	Year ended 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2025 (Unaudited)	Quarter ended 31.03.2025 (Audited)	Quarter ended 30.06.2024 (Unaudited)	Year ended 31.03.2025 (Audited)
Total income from Operations	31,238	41,028	25,812	124,902	98,385	89,344	80,597	325,554
Net profit /(loss) for the period ( before tax, exceptional and/or extra ordinary items)	6,372	15,201	3,753	31,121	16,425	18,967	10,851	53,421
Net profit /(loss) for the period before tax (after exceptional and/or extra ordinary items)	6,372	15,201	3,753	31,121	16,425	18,967	10,851	53,421
Net profit /(loss) for the period after tax (after exceptional and/or extra ordinary items)	4,790	13,733	2,779	26,626	10,952	15,350	6,867	39,180
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	4,790	13,677	2,779	26,570	16,406	14,727	8,484	40,867
Equity Share Capital	2,861	2,861	1,430	2,861	2,861	2,861	1,430	2,861
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	Rs.82,144/-Lakhs as on 31st March 2025		Rs.1,27,368/- Lakhs as on 31st March 2025			th 2025		
Earning per share (of Rs. 2 /- each) ( for continuing and discontinued operations)								
Basic	3.35	9.60	1.94	18.61	7.66	10.73	4.80	27.39
Diluted	3.35	9.60	1.94	18.61	7.66	10.73	4.80	27.39

Note: (1) The above is an extract of the detailed format of the Unaudited Financial Results of the Company for the Quarter ended 30th June, 2025 filed with the Stock Exchange und. Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full firmat of the Quarter ended 30th June, 2025 are available on the website SEB Limited at www.besindia.com, and on the website of the Company at www.besindia.com, 2017 he sold at www.selniadia.com, and on the website of the Company at www.besindia.com, 2017 he sold at www.selniadia.com, and on the vebsite of the Company at www.besindia.com, 2017 he sold at www.selniadia.com, and on the vebsite of the Company at www.besindia.com, 2017 he sold at www.selniadia.com, 2017 he sold at which are sold at wh Bs. Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company as www.bancoindia.com, 27 he above results (Standalone and Consolidated) have been prepared in accordance with Indian Accounting Standards (IND AS) notified under section 133 of the companies Act 2013, read together with relevant rules issued there under and other accounting principles generally accepted in India, During the year 2024-25, 71,518,650 sequity shares of Face-Value of Rs. 2-4. were allotted to the eligible holders of equity shares on the record date (i.e. 301,12024) as bonus equity shares by Capitalizing Securities Premium Rs. 1200.31 Labks and General Reserve Rs. 200.61 Labks, In accordance with the 'Ind AS 33 - Earning per share, the figures of Earning Per Share for the period June 24 has been restated to give effect to the allottment of the bonus shares.













